



**મારા આહારમાં જંતુનાશક ઝેર?
નહીં ! કદાપિ નહીં.....**

રોજ એક સફરજન ખાઓ અને આરોગ્યને હાનિ પહોંચાડો. જી હા, તમે સાચું વાંચ્યું! સરકારના અહેવાલ જ જણાવે છે કે આપણા આહારમાં ક્લોરડેન, હેપ્ટેક્લોર અને ડી.ડી.ટી. જેવા પ્રતિબંધિત જંતુનાશક મોજુદ છે. દા.ત. ક્લોરડેન જ્ઞાનતંતુઓને અત્યંત નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં, એ યકૃત, ફેફસાં, મૂત્રપિંડ અને આંખ માટે પણ હાનિકારક છે. વળી, જે જંતુનાશકો અમુક પાક માટે નથી હોતાં, છતાં એજ પાકમાં એ જંતુનાશકના અંશ મળી આવ્યા છે.

કાયદા પ્રમાણે તો તાત્કાલિક અને લાંબા ગાળાની આરોગ્યની સમસ્યા પેદા કરતો અને વ્યાપકપણે વપરાતો “મોનોક્રોટોફોસ” જંતુનાશકનો શાકભાજી પર છંટકાવ કરવા પર પ્રતિબંધ છે. તેમ છતાં, વારંવાર કરાયેલા વિવિધ પરિક્ષણોમાં શાકભાજીમાં એના અંશ મળી આવ્યા છે. જે જંતુનાશકો ખેતીમાં વાપરવાની પરવાનગી છે એના અંશ પણ આપણા આહારમાં કાયદેસર મર્યાદા કરતા ઘણી વધારે માત્રામાં જોવા મળે છે. આપણા ખોરાક, જાડસ્રોત અને જમીન કેવી રીતે આ ઝેરી રાસાયણિક જંતુનાશકોથી પ્રદૂષિત થઈ રહ્યા છે એની તો આ માત્ર ઝલક છે.

જરા વિચારો કે તમે સુપરમાર્કેટમાંથી કે કાઠિયા પાસેથી વીણીને તાજા ફળ-શાકભાજી લાવો છો, એને સરખા ધોઈને, સમારીને, રાંધીને કુટુંબીજનોને ખવડાવો છો: ફક્ત એટલા માટે કે તેઓને જંતુનાશક રૂપી ઝેર મળે....? ફળ-શાક, ઈંડા, માંસ અને દૂધ: આ બધામાં જંતુનાશકના અંશ સરકારી મર્યાદા કરતા અનેક ઘણા વધારે જોવા મળે છે. એટલું જ નહીં, આ રસાયણો ધોવાઈને આપણા જાડસ્રોતમાં ઉતરે છે. આઘાતજનક વાત છે કે માનું દૂધ પણ આ ઝેરથી મુક્ત નથી! તેમ છતાં દેશમાં ઝેર ફેલાવતા આ કાર્યને નિયંત્રણમાં લાવવાનું કે બંધ કરાવવાનું કામ કોઈ નથી કરી રહ્યું!

સરકાર લેશમાત્ર પણ સજાગ નથી !

સમસ્યાનું મૂળ આપણા ખેતરોમાં છે. આ સમસ્યાની જાણ હોવા છતાં અને રાસાયણિક કીટનાશકોનો વિકલ્પ હોવા છતાં સરકાર કૃષિ ક્ષેત્રમાં જંતુનાશકોના ઉપયોગને ટેકો આપે છે. આના કારણે જનતાના સ્વાસ્થ્યના ભોગે પેસ્ટીસાઈડ ઉદ્યોગ પાંગરતો જાય છે-સમૃદ્ધ થતો જાય છે. એટલું જ નહીં,

સરકારે આ સમસ્યાના ઉકેલ તરીકે જેનેટિકલી મોડીફાઈડ (જી.એમ.) પાકને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે. જી.એમ. પાક આરોગ્ય માટે જોખમી તો છે જ, પણ એની આડ અસરમાંથી પાછા વળવું અસંભવ છે. ખરું જોતાં સરકારે સલામત વૈકલ્પિક કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું જોઈએ. આજની તારીખમાં એવા વિકલ્પોને વ્યાપક બનાવી શકાય એ માટે સરકાર તરફથી પણ સમકક્ષ વ્યવસ્થા નથી. એટલે જ આપણા ખેડૂતોને જંતુનાશક દવાઓ વાપર્યા સિવાય છુટકો નથી. એ જ ખેડૂતો કૃષિ ક્ષેત્રે વધતી મોંઘવારી, અનહદ દેવું, રાસાયણિક પેસ્ટીસાઈડ્સના ઉપયોગને કારણે પેદા થતી આરોગ્યાની સમસ્યા અને બીજી અનેક ઉપાધિઓને કારણે પરેશાન છે.

આશાનું એક કિરણ દેખાય છે !

દુનિયાભરમાં થઈ રહેલા સંશોધન પરથી સાબિત થઈ ચૂક્યું છે કે સલામત વૈકલ્પિક કૃષિ પદ્ધતિ અસરકારક અને લાભદાયક છે. દા.ત. આંધ્રપ્રદેશમાં લાખો ખેડૂતો નોન પેસ્ટીસાઈડલ મેનેજમેન્ટ (એન.પી.એમ.) તરીકે ઓળખાતા સલામત વિકલ્પ તરફ વળ્યા છે. એમના અહેવાલો મુજબ આ પદ્ધતિ વધુ નફાકારક છે. જો ખેતરોમાં રસાયણોનો છંટકાવ જ નહીં થાય તો આપણા આહારમાં પણ એના અંશ નહીં આવે. પરંતુ સરકાર આવા પ્રયાસોને પ્રોત્સાહન આપતી નથી.

આપણે - ગ્રાહકોએ જ એક થવું પડશે અને સલામત આહારની માગણી કરવી પડશે. સુરક્ષિત આહાર મેળવવો એ આપણો હક્ક છે.

ચાલો...ઝેર આરોગતાં આપણે સર્વ નાગરિકો સરકાર પર પેસ્ટીસાઈડ ઉદ્યોગોના નફાની ચિંતા છોડવાનું અને પ્રજા-પર્યાવરણની ચિંતા કરવાનું દબાણ લાવીએ.

આપણે સરકાર પાસે માગણી કરીએ કે.....

- રાસાયણિક કીટનાશકો અને જી.એમ. ટેકનોલોજી વિના થતી સજીવ ખેતી/ પર્યાવરણને અનુકૂળ એવી/ શાશ્વત ખેતીને પ્રોત્સાહન આપો.
- ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને બાળકો માટે ઓર્ગેનિક (સજીવ) આહારની વ્યવસ્થા કરો.
- બીજા દેશોમાં પ્રતિબંધિત કરાયેલા જંતુનાશકો પર આપણા દેશમાં પણ પ્રતિબંધ મૂકો.

www.indiaforsafefood.in આ વેબસાઈટ પર જઈને વધુ જાણો - સહકાર આપો - કાર્યરત થાઓ

www.indiaforsafefood.in/sendpetition પર જઈ અરજી વાંચી હસ્તાક્ષર કરો;

અને 022 - 33090039 પર મિસ કોલ કરો - અમે તમારી અરજી ભારતના કૃષિ મંત્રી ને મોકલશું.

વધુ વિગત માટે સંપર્ક કરો: તેજલ- tejal.roots@gmail.com ; વિપુલ- 9821546551 ; સંપ્રતિ- 9869068281;